

M.Com Semester - 3 (CBCS) Examination**DEC/JAN. - 2020 - [NEW COURSE]****Advanced Cost & Financial Accounting(Elective (New))****Time: 1:30 Hours****Marks: 42****Instructions:**

1. Figure to the right indicate marks.
2. There are five questions in the question paper.
3. Answer any three of the following questions.

પ્રશ્ન.૧ નીચેની માહિતી ગ્રીષ્મા મેન્યુફેક્ચરીંગ કંપની લી.ની ઉત્પાદનને લગતી માહિતી આપેલ છે. (૧૪)

વિગત	2019	2020
વેચાણ (₹)	2,00,000	2,40,000
નફો (₹)	20,000	28,000

ગણતરી કરો.

- નફા-જથ્થાનો ગુણોત્તર
- સ્થિર ખર્ચા
- જ્યારે વેચાણ રૂ. 1,80,000/- હોય ત્યારે નફો
- જ્યારે નુકશાન રૂ. 4,000/- હોય ત્યારે વેચાણ
- રૂ. 40,000/- નફો કમાવવા માટે જરૂરી વેચાણ
- સમતુલ બિંદુ
- રૂ. 1,50,000/- ના વેચાણે સલામતીગાળો

પ્રશ્ન.૨ કનિષ્ઠ કંપની લિમિટેડ સંકલિત હિસાબી પદ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે. નીચેના વ્યવહારોમાંથી (૧૪)

આમનોંધ લખો.

ક્રમ	વિગત	રકમ રૂ.
1	માલસામાનની ઉધાર ખરીદી	15,00,000/-
2	ઉત્પાદન વિભાગને આપેલ પરોક્ષ માલસામાન	5,00,000/-
3	માલસામાનનો સામાન્ય બગાડ	10,000/-
4	સ્ટોર્સમાંથી વેપારીને માલસામાન પરત	20,000/-
5	પ્રત્યક્ષ મજૂરી ઉત્પાદન ખાતે લઈ જવામાં આવે	50,000/-
6	સામાન્ય નિષ્ક્રિય સમયની મજૂરી	8,000/-
7	પ્રત્યક્ષ ખર્ચ ચુકવ્યો	30,000/-
8	કારખાના ખર્ચ ફાળવ્યો	10,000/-
9	વેચાણ અને વિતરણ ખર્ચ ચુકવ્યો	20,000/-
10	તૈયાર માલ	90,000/-
11	રોકડ વેચાણ	30,000/-
12	મશીનરી પરનો ધસારો	7,000/-
13	લેણદારને ચુકવ્યા	50,000/-
14	ઘાલખાધ	2,000/-

પ્રશ્ન.૩ SD કંપની લિમીટેડ બિનસંકલિત હિસાબી પધ્ધતિ દ્વારા તેના હિસાબો રાખે છે. તા. 01-04-2019 ની (૧૪)
કેટલીક બાકીઓ નીચે મુજબ છે.

વિગત	ઉધાર રૂ.	જમા રૂ.
ચાલુ કામ ખાતાવહી નિયંત્રણ ખાતું	52,000/-	
તૈયાર માલ ખાતાવહી નિયંત્રણ ખાતું	23,000/-	
કારખાના શિરોપરી ખર્ચ ખાતું	500/-	
વહીવટી શિરોપરી ખર્ચ ખાતું	300/-	
માલસામાન ખાતાવહી નિયંત્રણ ખાતું	11,500/-	
સામાન્ય ખાતાવહી નિયંત્રણ ખાતું		87,300/-
	87,300	87,300/-

વર્ષ 2019-20 ના દરમિયાનનાં વ્યવહારો :

વિગત	રકમ રૂ.
પ્રત્યક્ષ મજૂરી	75,000/-
પરોક્ષ મજૂરી	5,000/-
કારખાના પરોક્ષ ખર્ચ	14,500/-
વહીવટી પરોક્ષ ખર્ચ	11,700/-
ઉત્પાદન ખાતે વસુલ કરેલ કારખાના ખર્ચ	22,000/-
ઉત્પાદન ખાતે વસુલ કરેલ વહીવટી ખર્ચ	12,000/-
ઉત્પાદન અંગે આપેલ માલસામાન	49,000/-
વર્ષ દરમિયાન થયેલ તૈયાર માલની પડતર	1,80,000/-
વેચેલ માલ પડતર કિંમતે	1,90,000/-
માલસામાન ની ખરીદી	50,000/-
કારખાનામાં મરામત માટે મોકલેલ માલસામાન	2,000/-
ઉત્પાદન માટે પુરા પાડેલ માલસામાનનું આવકમાલ ગાડાભાડું	800/-
વેચાણ	2,10,000/-

કંપનીના પડતરના ચોપડામાંથી મેળવેલ ઉપરોક્ત માહિતી પરથી પડતર ખાતાવહીમાં જરૂરી ખાતા અને તા.31-03-2020 ના રોજ કાચું સરવૈયુ બનાવો.

પ્રશ્ન.૪ (A) બેંચ માર્કિંગનો અર્થ શું છે અને બેંચ માર્કિંગના પ્રકારો સમજાવો. (૦૭)

(B) બેલેન્સ સ્કોર કાર્ડના ફાયદા અને મર્યાદાઓ વર્ણવો. (૦૭)

પ્રશ્ન.૫ ટુંકનોંધ લખો. (કોઈપણ બે) (૧૪)

1. સમતૂટ બિંદુ વિશ્લેષણ
2. સંકલિત અને બિન-સંકલિત હિસાબી પધ્ધતિ વચ્ચેનો તફાવત
3. નફો જથ્થો વિશ્લેષણ – બહુવિધ ઉત્પાદન વિશ્લેષણ
4. બેલેન્સ સ્કોર કાર્ડના ચાર દ્રષ્ટિકોણ

ENGLISH VERSION

- Q.1 The following information is related to production of Grishma manufacturing company Ltd. (14)

Particular	2019	2020
Sale (Rs.)	2,00,000/-	2,40,000/-
Profit (Rs.)	20,000/-	28,000/-

Calculate :-

- (1) P/V Ratio.
 - (2) Fixed expenses.
 - (3) Profit where sale is Rs.1,80,000/-
 - (4) Loss where sale is Rs.4,000/-
 - (5) Sales to earn profit of Rs.40,000/-
 - (6) Break-even point
 - (7) When actual sales is Rs.1,50,000/-, margin of safety
- Q.2 Kanishk Co. Ltd. Keeps their accounts by Integrated accounting system. Write journal entries from the following transactions. (14)

Sr. No.	Particulars	Rs.
1	Credit purchase of material	15,00,000/-
2	Indirect material given to production	5,00,000/-
3	General wastage of material	10,000/-
4	Material Returned to supplier	20,000/-
5	Direct Labour transfer to production	50,000/-
6	Wages for normal Ideal time	8,000/-
7	Direct expenses paid	30,000/-
8	Factory overhead absorbed	10,000/-
9	Selling and Distribution overhead paid	20,000/-
10	Finished goods	90,000/-
11	Cash sales	30,000/-
12	Depreciation on machinery	7,000/-
13	Cash paid to Creditors	50,000/-
14	Bad Debts	2,000/-

- Q.3 SD Company maintains Non-integral accounting system. The following information on 01-04-2018 some balances were: (14)

Particulars	Debit Rs.	Credit Rs.
Work in progress Ledger control A/c	52,000/-	
Finished goods Ledger control A/c	23,000/-	
Factory overhead A/c.	500/-	
Administrative overhead A/c.	300/-	
Stores Ledger control A/c.	11,500/-	
General Ledger Control A/c		87,300/-
	87,300	87,300/-

Transactions during the year 2018-19 were as under :

Particulars	Debit Rs.
Direct wages	75,000/-
Indirect wages	5,000/-
Factory overheads	14,500/-
Administration overheads	11,700/-
Factory expenses recovered in production A/c	22,000/-
Administration expenses recovered in production A/c	12,000/-
Material issued for production	49,000/-
Cost of Finished goods during the year	1,80,000/-
Cost of goods sold	1,90,000/-
Purchase of material	50,000/-
Material issued for factory for repairing	2,000/-
Cartage inward of the materials issued for production	800/-
Sales	2,10,000/-

Prepare necessary accounts in the Cost Ledger from the above information received from the cost ledger of the company and also prepare Trial Balance as on 31-03-2019.

- Q.4 (A) What do mean of Bench Marking and explain the types of Bench Marking. (07)
- (B) Describe advantages and Limitations of Balanced Score Card. (07)
- Q.5 Write on Short note. (any two) (14)
1. Break Even Point analysis.
 2. Difference between integrated and non integrated accounts.
 3. Profit Volume Analysis-Multiple product analysis.
 4. Four perspectives of Balanced Score Card.
